

PART PLAN OF PRELIMINARY TOWN PLANNING SCHEME - 88 (VATVA-2)

Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat

Notification NO.: GH/V/24 OF 2020/TPS-112015- 2424-L, Dt:24/02/2020.

FINAL PLOT NO: 16/3



SCALE: 1c.m.=20 Mts.



This part plan is certified for the F.P NO: 16/3

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

LEGEND

- F.P BOUNDARY
- ROAD
- T.P.S.BOUNDARY

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

TRUE COPY

અરજદાર દ્વારા ઇ.નં. ૧૨૦૨૦૦૬૩૦/૩૭૧૩ તા. ૩૦/૬/૨૦૨૦ થી
નકલની મોગાણી કરેલ હોઈ પહોંચ નં. ૩૩/૩૩ તા. ૩૦/૬/૨૦૨૦
૩૧/૦૮/૨૦૨૦...વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

[Signature]
3/7/2020

TOWN PLANNING INSPECTOR
TOWN PLANNING DEPARTMENT

[Signature]
3/7/2020

[Signature]
3/7/2020

PART PLAN SHOWING
R.S. NO.:- 910/3
VILLAGE :- VATVA
TALUKA:-VATVA
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 20 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt.of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Residential Zone I-R1
Village Boundary
TPS Boundary
Existing Road
Proposed Road
Waterbody



This part plan is certified for the R.S. NO. :- 910/3

- NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2020.0630./2302
Amount Recieved Rs. 1000/-
Receipt No. 733/76 Dtd. 30/6/2020.

TRUE COPY

TOWN PLANNING INSPECTOR